

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો

પ્રાયોગિક સહભાગીઓ

અધિકારોનું બીલ

નીચેનાં અધિકારો જેમને સંશોધન અભ્યાસોમાં રહેવાનું કહેવામાં આવે છે તેવા દરેક વ્યક્તિના અધિકારો છે. પ્રાયોગિક સહભાગી તરીકે મારી પાસે નીચેના અધિકારો છે:

- 1) કહેવામાં આવે કે અભ્યાસ શું શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે,
- 2) મને શું થશે અને કોઈપણ કાર્યવાહી, દવાઓ, અથવા સાધન પ્રમાણભૂત પ્રથામાં ઉપયોગમાં લેવાતા હોય તેનાથી અલગ છે કે કેમ, તે અંગે કહેવામાં આવે,
- 3) અભ્યાસના હેતુઓ માટે મારી સાથે થશે તે વસ્તુઓના વારંવાર થતા અને/અથવા મહત્વના જોખમો, આડઅસરો અથવા અસુવિધાઓ અંગે કહેવામાં આવે,
- 4) ભાગ લેવાથી હું કોઈ અપેક્ષા રાખી શકું અને જો એમ હોય તો ક્યા લાભ હોઈ શકે, તે અંગે કહેવામાં આવે,
- 5) મારી પાસે રહેલી અન્ય પસંદગીઓ અને તે અભ્યાસમાં રહેવા કરતા કઈ રીતે સારી અથવા ખરાબ હોઈ શકે તે કહેવામાં આવે,
- 6) સામેલ થવા માટે સહમત થતા પહેલા અને અભ્યાસ દરમિયાન અભ્યાસ સંબંધિત કોઈપણ પ્રશ્ન પૂછવાની મંજૂરી આપવામાં આવે,
- 7) જો કોઈ જટિલતાઓ ઉભી થાય તો ક્યા પ્રકારની તબીબી સારવાર ઉપલબ્ધ છે તે કહેવામાં આવે,
- 8) ભાગ લેવા માટે બિલકુલ ઇનકાર કરવાનો અથવા અભ્યાસ શરૂ થઈ જાય પછી સહભાગિતા અંગે મારો વિચાર બદલવાનો. આ નિર્ણય, જો હું અભ્યાસમાં ન હોઉં તો મેં મેળવી હોત તેવી સંભાળ મેળવવાના મારો અધિકારને અસર નહિ કરે,
- 9) હસ્તાક્ષર કરેલ અને તારીખ નાંખવામાં આવેલ સંમતિ પત્રકની એક નકલ

મેળવવી,

- 10) અભ્યાસમાં રહેવા માટે હું સંમત થવા ઈચ્છું છું કે કેમ તે વિચારતી વખતે દબાણથી મુક્ત રહેવું.

જો મને અન્ય પ્રશ્નો હોય જે સંશોધનકર્તા અથવા સંશોધન સહાયકને મારે પૂછવા જોઈએ. વધુમાં હું સંશોધન પ્રોજેક્ટમાં સ્વયંસેવકોની સુરક્ષાથી સંબંધિત માનવ સંશોધન સમિતિનો સંપર્ક કરી શકું છું. હું નીચે મુજબ ફોન કરીને સમિતિની ઓફિસ સુધી પહોંચી શકું છું: (415) 476-1814 સવારના 8:00 થી સાંજે 5:00, સોમવાર થી શુક્રવાર, અથવા UCSF હ્યુમન રિસર્ચ પ્રોટેક્શન પ્રોગ્રામ, બોક્સ 0962, 3333 કેલિફોર્નિયા એસટી., એસટીઈ. 315 સાન ફ્રાન્સિસ્કો, સીએ 94143 માહિતી અને અનુવાદ માટે 476-1814 પર ફોન કરો.

ગુજરાતી – 8/16

Researchers: If using the [“short form” method](#) of consent, affirm the following and obtain the signatures below:

The elements of consent were presented orally on _____(date).

Subject Signature

Witness Signature